

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૧/૮/૨૦૧૫ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:- સમાચાર યાદી નં.૧૬૨૨/૧૫

અમદાવાદ તથા વિસનગર વિસ્તાર માંથી વાહનચોરી કરનાર અને
છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી કાઇમબ્રાન્ચ

અમદાવાદ શહેર કાઇમ બ્રાન્ચનાં નાયબ પોલીસ કમિશ્નર શ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં બનતાં મિલકત સંબંધી ગુન્હાઓને શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.પી. રોજીયા નાઓના સ્કોડનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.આઇ. જાડેજા તથા શ્રી એસ.એન.દેસાઇ તથા સ્ટાફનાં માણસો સાથે અમદાવાદ શહેરમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે, હેબતપુર ચાર રસ્તા પાસેથી આરોપી ૧.મનીષ ઉર્ફે મનીયો ઉર્ફે કાળુ S/O કાન્તિભાઇ જાતે પ્રજાપતિ ઉવ.૩૦ રહે.હાલ હેબતપુર ચાર રસ્તા , પે એન્ડ યુઝ પાસે કુટપાથ ઉપર એસ.જી.હાઇવે અમદાવાદ શહેર મુળ વતન ગામ:- વાલમ, તા.વીસનગર , જી.મહેસાણા નાને તા.૧૦/૦૮/૨૦૧૫ ના રોજ પકડી અટક કરવામાં આવેલ

આ કામે પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતાં અગાઉ તે પોતાના વતન મા રહેતો હતો અને છુટક મજૂરી કામ કરતો હતો તે દરમ્યાન વિસનગર,સિધ્ધપુર,મહેસાણા તથા અમદાવાદ શહેર માંથી ટુ-વ્હીલર વાહનો ની ચોરી કરેલ તે મોટર સાયકલો પોતાના ગામ મા રહેતા બાબુ વણઝારા ને વેચવા તથા સાચવવા આપેલા તે દરમ્યાન સ્થાનિક પોલીસ વાલમ ગામે જતા આરોપી મનીષ ઉર્ફે મનીયો ભાગી ગયેલ અને ત્યારથી અમદાવાદ ખાતે આવી દિવસ દરમ્યાન છુટક મજૂરી કામ કરી લેતો અને રાત્રિના સમયે ગમે ત્યા કુટપાથ ઉપર સુઇ રહેતો હતો આ આરોપી એ વાહન ચોરી ના કેટલા ગુન્હા આચરેલ છે અને કેટલા વાહનો કોને કોને વેચેલ છે તે દિશામા તપાસ ચાલુ છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.